

લોન એકાઉન્ટ ના SMA અને NPA તરીકે વર્ગીકરણ પર ગ્રાહક જાગૃતિ

આ સંદેશો અમારા ગ્રાહકોની RBI નિયમનો મુજબ ચડત રકમની તારીખ, SMA અને NPA વર્ગીકરણ તથા દિવસના અંતે કરવામાં આવતી પ્રોસેસની નિર્દિષ્ટ સંદર્ભમાં અપ-ગ્રેડેશન પરના મૂળ સિદ્ધાંતની જાગૃતિ વધારવા માટે છે.

આવકની ઓળખ પરના “વિવેકપૂર્ણ માનદંડ મિલકતનું વર્ગીકરણ અને એક્વાનિસિઝને લગત પ્રાવધાન કરવાની-સ્પષ્ટતાઓ” પરની Reserve Bank of India (RBI)ની માર્ગદર્શકરેખાઓ, તારીખ 12 નવેમ્બર, 2021 અને ફેબ્રુઆરી 15, 2022નો પરિપત્ર-માસ્ટર ડાઇરેક્શન-રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની –સ્કેલ બેઝ્ડ રેગ્યુલેશન્સ), 2023 જુઓ (જેનો હવે પછી “SBR” તરીકે ઉલ્લેખ થશે), તેમાં જાહેર કર્યા મુજબ, RBI, ખાતાના ઓવરડ્રુ અને સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ (SMA) / નોન-પરફોર્મિંગ એસેટ (NPA) વર્ગીકરણ અને અપગ્રેડેશનના મૂળ સિદ્ધાંત, જે નીચે દર્શાવેલ છે, તે મુજબ, બધી જ ધિરાણ સંસ્થાઓ માટે એક સમાન હોય તેની ખાતરી રહે.

લેણાની પાકતી તારીખ/પરત ચૂકવણી તારીખ: આ એ તારીખ છે કે જે દિવસે હપતાનું, જે લોન ખાતા પરના મુદ્દલ/વ્યાજ સમાવે છે, બિલ બનેલ છે અને જે મુદ્દતી/લોન એગ્રીમેન્ટના મંજૂરી પત્રમાં દર્શાવ્યા મુજબ ચૂકવવા પાત્ર બને છે.

ચડત (ચૂક) ખાતું: ખાતું ચૂક વાળું બનશે જ્યારે મુદ્દલ/હાનાની ચડત રકમ પૂરેપૂરી ચૂકવવામાં આવી ન હોય, જેની જે તે પાકતી તારીખ, મુદ્દતી/ લોન એગ્રીમેન્ટ પર, દર્શાવેલ છે તેવા ખાતા ઓવર ડ્રુ લોન એકાઉન્ટ તરીકે નિર્દિષ્ટ થશે. કંપની નિયત તારીખ માટે ડે-એન્ડ પ્રક્રિયાઓના ભાગ રૂપે લોન એકાઉન્ટને મુદતવીતી તરીકે ચિહ્નિત કરશે, આવી પ્રક્રિયાઓ ચલાવવાનો સમય ગમે તે હોય.

લોનનું વર્ગીકરણ માટેના આધાર: વધુ સારી સમજૂતી માટે, કોઈ લોન ખાતાના, SMA અને NPA તરીકે વર્ગીકરણ માટેના આધાર અને તેના જ એક ઉદાહરણ માટે, નીચે દર્શાવેલ છે:

SMA 0: 30 દિવસો સુધી


SMA 1: 31 થી 60 દિવસો માટે

SMA 2: 61 થી 90 દિવસો માટે

NPA: 90 દિવસથી વધુ

લોન ખાતાનું SMA અથવા NPA તરીકે વર્ગીકરણ દિવસના અંતે, જે તે સંબંધિત તારીખ માટે થતી પ્રક્રિયાના ભાગ રૂપે કરવામાં આવે છે અને SMA અથવા NPA વર્ગીકરણ તારીખ કેલેન્ડર તારીખ હશે જે દિવસે કંપની દ્વારા ડે-એન્ડ પ્રોસેસ ચલાવવામાં આવે છે.

SMA/NPA વર્ગીકરણ માટેનું ઉદાહરણ: જો લોન ખાતાની નિયત તારીખ 31 માર્ચ, 2021 છે, અને કંપની આ તારીખ માટે ડે-એન્ડ પ્રક્રિયા ચલાવે તે પહેલાં સંપૂર્ણ બાકી રકમ પ્રાપ્ત ન થાય, તો મુદતવીતી તારીખ 31 માર્ચ, 2021 રહેશે.



જો આ લોન ખાતું ચડત લેણા તરીકે 30 દિવસ સુધી ચાલુ રહે તો પછી તેને SMA-0 (શૂન્ય) તરીકે વર્ગીકૃત કરવામાં આવશે. આગળ પર, જો તે ચડત રકમવાળા ખાતા તરીકે ચાલુ રહે તો પછી આ ખાતાને SMA-1 તરીકે, એપ્રિલ 30, 2021ના રોજ, ડે-એન્ડ પ્રોસેસ ચલાવીને ટેગ કરવામાં આવશે, એટલે કે ઓવર ડ્યુ તરીકેના સતત 30 દિવસો પૂર્ણ થતાં. તે મુજબ આ ખાતાની SMA-1 વર્ગીકરણની તારીખ એપ્રિલ 30, 2021 રહેશે.

એ જ રીતે, જો એકાઉન્ટ ઓવર ડ્યુ તરીકે સતત ચાલુ જ રહે છે તો, તે SMA-2 તરીકે મે 30, 2021 ના રોજ ડે-એન્ડ પ્રોસેસ ચલાવીને ટેગ થશે અને વધુ આગળ પર તે ઓવર ડ્યુ તરીકે ચાલુ રહે છે તો, તે ડે-એન્ડ પ્રોસેસ ચલાવીને NPA તરીકે અસ્તિત્વમાં રહેલ મિલકત વર્ગીકરણ નિયમો મુજબ વર્ગીકૃત થયેલું બનશે.

SBR મુજબ કોઈ લોન એકાઉન્ટ NPA તરીકે વર્ગીકૃત થયું છે તે સ્ટાન્ડર્ડ એસેટ તરીકે ફક્ત જો મુદ્દલ, વ્યાજ અને/અથવા અન્ય પાકતી અને ચૂકવાવપાત્ર બનતી આખી ઊભી રહેતી રકમ અપગ્રેડ થઈ શકે છે પૂરેપૂરી ચૂકવેલી છે તો [અહીં અભિવ્યક્તિ “સ્ટાન્ડર્ડ એસેટ” નો અર્થ અને ઉલ્લેખ થાય છે કે કોઈ લોન એકાઉન્ટ જેને SMA કે NPA તરીકે વર્ગીકૃત કરવાની કોઈ જરૂર નથી].

અગાઉ જણાવ્યા મુજબ, કંપની તેના ગ્રાહકોને હતા અને અન્ય રકમ, જો કઈ હોય તો, જે તે ડ્યુ ડેટ પર, મોડુ અને ચૂક કર્યા વિના ચૂકવવાની અને તેમનું ખાતું SMA કે NPA વર્ગીકૃત બનતું નિવારવાની સલાહ આપે છે.

અગત્યની નોંધ:

- તમારો હમો સમયસર ચૂકવો, જે તમને ક્રેડિટ સ્કોર બંધવામાં મદદ કરે છે.
- વધુ ઊંચો ક્રેડિટ સ્કોર તમને નીચા વ્યાજ દર સાથે વધુ ઊંચી લોન વેલ્યુ મેળવવામાં મદદ કરશે.